

ત્વરિત જાહેરાત માટે

સીટીએ સગવડો સુરક્ષિતપણે પુનઃશરૂ કરવા અને સીટી સેવાઓ ફરી શરૂ કરવા મેયર્સ વર્કિંગ ગ્રૂપ ઓન ફેઝડ પ્લાન (મેયરના તબક્કાવાર આયોજન માટેનું કાર્યકારી સમૂહ) શરૂ કર્યું

બ્રમ્પટન, ઓન્ટેરિયો (એપ્રિલ 22, 2020) – આજે, સીટીએ ઘોષણા કરી કે સમુદાયના આરોગ્ય અને સુરક્ષાને અગ્રતા આપવાનું ચાલુ રાખવાની સાથે સાથે, મેયર્સ વર્કિંગ ગ્રૂપ સીટીની સગવડો છેવટે પુનઃ શરૂ કરવા અને અસર પામેલા કાર્યક્રમો અને સેવાઓ ધીરધીરે ફરી શરૂ કરવા માટે એક વિગતવાર આયોજન પ્રક્રિયા શરૂ કરશે.

રીજીયનલ કાઉન્સિલર માર્ટિન મેડેરોસ (Martin Medeiros) ની આગેવાનીમાં અને બ્રમ્પટન ઈમરજન્સી મેનેજમેન્ટ ઓફિસના માર્ગદર્શન પ્રમાણે, વર્કિંગ ગ્રૂપ સીટીની સગવડો સુરક્ષિત અને કાળજીપૂર્વક ઉતાવળ કર્યા વગર ફરી શરૂ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ ગ્રૂપ તબક્કાવાર પુનઃશરૂઆત દરમિયાન વિશિષ્ટ COVID-19 ટાસ્ક ફોર્સને માર્ગદર્શન આપવાની પ્રક્રિયાઓ પર સલાહ આપશે જેથી કરીને રહેવાસીઓ, ધંધાઓ અને કર્મચારીઓને જરૂરી સહાયતા મળવાનું ચાલુ રહી શકે. આ ગ્રૂપ સરકારના જુદા જુદા સ્તરો, રમતવીરો અને કલાકાર સમૂહો, અને રહેવાસી મંડળોની સુરક્ષા જરૂરિયાતો અને ઈચ્છિત પરિણામો પર તેઓ સાથેની ભાગીદારીમાં સલાહ-મસલતોની આગેવાની કરશે.

રીજીયન ઓફ પીલ માટે ચેર ઓફ હ્યુમન સર્વિસીસ (માનવ સેવાઓના અધ્યક્ષ) તરીકે, કાઉન્સિલર મેડેરોસ (Medeiros) અને વર્કિંગ ગ્રૂપ બંને પીલ પબ્લિક હેલ્થ, ગવર્નમેન્ટ્સ ઓફ ઓન્ટેરિયો એન્ડ કેનેડાની સલાહ પર અવલંબિત રહેશે, અને શહેરના ચાર મેયરોના ટાસ્ક ફોર્સિસ વચ્ચે સહયોગ સાધશે. આ ગ્રૂપ સીટીની સર્વિસીસની પહોંચ, આરોગ્ય અધિકારીઓએ આપેલી સલાહ પ્રમાણે સર્વિસમાં જરૂરી ફેરફારો, અને શહેર માટે ધંધો કરવા નવી રીતો પ્રમાણે ઉપલબ્ધ તકો માટે રહેવાસીઓ અને ધંધાકીય સમુદાય પાસેથી મળેલી ભલામણો પર મેયરને સલાહ આપશે. આ ગ્રૂપ શહેરની સંચાલન કામગીરીઓ પર COVID19 નાં નાણાકીય પ્રભાવો ઘટાડવામાં મદદરૂપ થતા સરકારના અન્ય સ્તરો પાસેથી ઉપલબ્ધ શ્રેણીબદ્ધ ભંડોળ તકોની પણ શોધખોળ કરશે.

આ વિગતો અને સલાહ મેયર સાથે વહેંચવામાં આવશે અને ભવિષ્યની તારીખે સીટી કાઉન્સિલ દ્વારા વિચારવામાં આવશે.

માર્ચ 16 સુધીમાં, સીટીએ સીટી હોલ સહિતની શહેરની સગવડો બંધ કરી હતી અને ચોક્કસ કાર્યક્રમો અને આયોજનો રદ કર્યા હતા. સીટી ઓફ બ્રમ્પટનમાં માર્ચ 24 નાં રોજ સમગ્ર રાજ્યને આવરી લેતી કટોકટીની ઘોષણા કરવામાં આવી હતી. તે સમયથી અત્યાર સુધીમાં થયેલા વધારે ક્લોઝર્સ અને શહેરની આયોજનો અને તહેવારો રદ થવાનું જુલાઈ 2, 2020 સુધી અમલમાં રહેશે. શહેરની સગવડો આજની તારીખે આગળ નોટિસ આપવામાં આવે ત્યાં સુધી બંધ રહેશે.

સૌથી તાજેતરની અદ્યતન માહિતીઓ અને વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs) માટે, કૃપા કરી વેબસાઈટ જુઓ:

www.brampton.ca/COVID19.

અવતરણો (ક્વોટ્સ):

“પ્રોવિન્સની થયેલી પ્રગતિ પર આ અઠવાડિયાની શરૂઆતમાં કરેલી ઘોષણા એક આશાનું કિરણ અને ઘણાં લોકોની સખત મહેનત એમ બંનેની નિશાની સૂચવે છે. હું આપણાં સમુદાયની સામુહિક ક્રિયાથી પ્રોત્સાહિત થયો છું પરંતુ એ પણ જાણું છું કે આપણે આ વાઈરસ સામેની આપણી લડાઈમાં હજુ પણ ઘણી લાંબી લડત ચાલુ રાખવી પડશે. અમારું ધ્યાન કટોકટીને પ્રતિભાવ આપવાથી ખસીને શહેર ફરી ધમધમતું કરવા પર કેન્દ્રિત થવા જઈ રહ્યું છે ત્યારે, અમારી ટોચની અગ્રતા આપણાં સમુદાયનું આરોગ્ય અને સુરક્ષા પર બની રહેશે. આપણે સૌએ સામાન્ય જીવન તરફ પાછાં વળવામાં એક ભૂમિકા ભજવવાની રહે છે, અને હું રહેવાસીઓને વ્યક્તિઓ વચ્ચે શારીરિક અંતર જાળવવાનું આચરણ મહેરબાની કરીને ચાલુ રાખવા અને પીલ પબ્લિક હેલ્થની સલાહને અનુસરતા રહેવાનું યાદ અપાવું છું.”

- પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રમ્પટન

“બ્રમ્પટનના રહેવાસીઓ અને ધંધાઓ મહેનતુ અને લચીલા છે. સાથે મળીને, અમે સુરક્ષિતપણે અને તબક્કાવાર, રહેવાસીઓ અવલંબિત છે તેવી મહત્વની સેવાઓ પૂરી પાડતા સીટી હોલને ફરી શરૂ કરવા માટેની માર્ગરેખા બનાવીશું. મેયર્સ વર્કિંગ ગ્રૂપ એ સલાહ પૂરી પાડશે જે ખાતરી કરાવે કે અમે ટાસ્ક ફોર્સે પૂરી પાડેલી સહાયતા વિતરિત કરવાનું ચાલુ રાખીએ છીએ, અને આપણાં રોજીંદા જીવનને સહાયરૂપ બનતી સીટી દ્વારા પૂરી પડતી શ્રેણીબદ્ધ સેવાઓ ફરી શરૂ કરવા શાણપણભર્યો અભિગમ દેખાડે છે.”

- માર્ટિન મેડેયોસ (Martin Medeiros), રીજીયનલ કાઉન્સિલર, વોર્ડ્સ 3 અને 4

“શહેરને ફરી ખોલવામાં સંખ્યાબંધ પરિબળોને ધ્યાનમાં રાખીને અને અમારા આરોગ્ય સંભાળ નિષ્ણાતોની સલાહને અગ્રેસર રાખીને કાળજીપૂર્વકનું આયોજન કરવાની જરૂર પડશે. આ વર્કિંગ ગ્રૂપ હવે બનાવવાથી અમારો અભિગમ વિચારપૂર્વક વિકસાવવામાં અમારી ટીમને જરૂરી સમય મળી રહેશે અને અમે સગવડો ફરી શરૂ કરવા અને ધંધાઓ અને કાર્યક્રમો ફરી ચાલુ કરવા પૂરેપૂરા તૈયાર હોવાનું ક્યારે સુરક્ષિત બની રહેશે તેની ખાતરી કરી શકીશું.”

- ડેવિડ બાર્રિક (David Barrick), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સીટી ઓફ બ્રમ્પટન

-30-

મિડિયા સંપર્ક :

મોનિકા દુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca